

## ધર્મ-સ્થાનકોએ જવાનું બંધ કરી દો...

- ઐઋષિ

પ્રિતેશભાઈ

હા, તમે બરાબર તમે બરાબર વાંચ્યું છે, ધર્મ-સ્થાનકોએ જવાનું બંધ કરી દો. કેમકે જીવતા ભગવાનને મૂકીને જો તમે પ્રતિમાજીઓ કે ઇષ્ટ પરમાત્માઓને પ્રણામ કરવા જશો તો તમને તેનું ફળ 100 ટકા નહીં જ મળે. કેમકે જે ઇષ્ટને તમે પ્રણામ કરો છો તેઓનાં ઉપદેશને વાંચશો તો તેઓ પણ કહેશે કે મેં તમને જે જીવંત દેવ આપ્યા છે તેમને મૂકીને એમને શા માટે પ્રણામ કરવા આવ્યા? તમે મારા પ્રતિનિધિનું અપમાન કરો છો અર્થાત્ મારું જ અપમાન કરો છો.

હવે તો સમજી ગયા જ હશે છતાં કહું છું કે ઘરમાં જે જીવતા ભગવાન છે તે બીજા કોઈ નહીં પરંતુ તમારા માતા-પિતા અને વડીલો છે. હા, એક નવી વાત જે શાસ્ત્રમાં આમ તો સ્પષ્ટ લખી નથી પરંતુ બાળકો પણ ભગવાનનાં જ અવતાર છે. આજે તો તમે અખબારમાં વાંચો છો અથવા તમારા કોઈ ચિત્ત-પરિચિત પાસે સાંભળવા મળ્યું હશે કે એક કડુણ કિસ્સો... સગી જનેતા જ નાની બાળકી કે બાળકને તરછોડીને ચાલી ગઈ કે ચાલ્યા ગયા. એટલેજ ટીનેજર્સ છે તેને પણ સૂચવું છું કે બાળકો પણ ભગવાનનું સ્વરૂપ છે. એવું પગલું ક્યારેય ન ભરતા કે નાના બાળકોને કે નવજાતને તરછોડવાનો સમય આવે. પછી તે આપણી સંસ્કૃતિની વિરુદ્ધ છૂટાછેડાની વાત કેમ ન હોય.

આજે લોકો એવી માનસિકતામાં મુકાયા છે કે મને શું લાભ? તમે પોતે પણ એ સાક્ષી છો કે ગુજરાતમાં ભયંકર ભૂકંપ આવ્યો પછી ધર્મ-સ્થાનકોમાં જનારાઓની સંખ્યામાં પણ વૃદ્ધિ થઈ હતી. તો હવે હું તમારા લાભની વાત કરું છું કે તમે જીવતા ભગવાનને પૂજશો તો તમે જે ધર્મ-સ્થાનકે અથવા ઇષ્ટની ઉપાસના કે પ્રણામ-વંદન કરવા જવાના હશો ત્યાં તમે જો પૂર્ણ શ્રદ્ધા રાખીને જશો તો તમારી યોગ્યતા મુજબનું 100 ટકા ફળ મળશે જ. હા, હા 100 ટકા ફળ મળશે.

પરંતુ તમારા ઘરમાં રહેલા માતા-પિતા, વડીલો અને બાળકોને તરછોડવાની વાત કરશો તો તમે ક્યારેય સુખી નહીં થઈ શકો. સુખ તો દૂરની વાત છે માનસિક સ્વસ્થતા પણ નહીં કેવી શકો. મહાભારતનાં આદિ પર્વમાં કહ્યું છે કે બધા જ પાપોનું નિવારણ કરી શકાય છે પરંતુ માતા દ્વારા શાપ અપાયેલા પુત્રોનો ક્યારેય છૂટકારો થઈ શકતો નથી.

એક બીજી વાત આજના મનુષ્યને બે વસ્તુ જોઈએ છે. એક તો ક્યારેય જીવનમાં સંકટ ન આવવું જોઈએ અને ધન-અર્થ મળવું જોઈએ. આ બે વસ્તુ તમારે જોઈએ છે? તો જ આગળ વાંચજો. કેમકે આ વસ્તુ હું તમને સો એ સો ટકા અપાવી શકું છું. હા બરાબર જ વાંચ્યું. તમને અપાવી શકું છું. ભારતીય ગ્રંથોમાં લખ્યું છે કે જે મનુષ્ય ધર્મ-પરાયણ હોય તેને ક્યારેય સંકટ આવતા નથી.

જ્યારે તમારે અર્થ એટલેકે ધન મેળવવું હોય તો ધર્મનું પાલન કરવું જોઈએ. કેમકે ધર્મ અર્થ-ધનથી જુદું નથી રહી શકતું. જે રીતે સ્વર્ગ અને અમૃત. અમૃત સ્વર્ગમાં જ મળે. તે જ રીતે ધન જોઈતું હોય તો

ધર્મનું પાલન કરવું પડે. તેનાં નિયમ મુજબ અનુસરવું પડે. કોઇપણ ક્ષેત્રમાં જાવ, તેનાં નીતિ-નિયમોનું પાલન કરો તો પ્રગતિ અચૂક થવાની જ છે.

હવે તમે કહેશો કે ધર્મ એટલે શું? તેનાં માટે શાસ્ત્રો વાંચવાનો ટાઇમ જ ક્યાં છે? તો આપણે સાદી અને સરળ ભાષામાં સમજવું હોય તો જીવનમાં પ્રત્યેક જીવ માટે દયાભાવ રાખવો અને મનુષ્ય કરતા વિરુદ્ધ વર્તન ન કરવું તે ધર્મ છે. જીવનમાં આગળ વધવું હોય તો સદાચાર યુક્ત આચરણ રાખવું. તમે જે કમાણી કરો છો તેનો તમારા માટે તો શ્રેષ્ઠ રીતે ઉપયોગ કરો. સાથે સમાજ માટે પણ દાન કરતા શીખો.

ફરીથી કહુ છું કે માત્ર ધર્મ સ્થાનોએ જવાથી તમે ધાર્મિક થઇ જશો એવું નથી પરંતુ તમારે ધર્મમય જીવન જીવવાનું છે. માતા-પિતા, બાળકોને તરછોડશો તો તમને તમારા ઇષ્ટદેવનાં આશિષ ક્યારેય નહીં મળે. તેમજ તમને અંદરથી એક ડંખ આજીવન રહેશે કે મેં કેવું વર્તન કર્યું. આ ઘા કોઇ ડોક્ટર દૂઝવી શકતો નથી. આ તમને જે કંઇક ડંખે છે, તે પાપ. તેની બીજી કોઇ વ્યાખ્યા નથી. માટે આવા ડંખ-પાપ વગરનું જીવન જીવશો તે જીવન ધર્મમય જીવન થયું. ઇશ્વર બધે ના પહોંચી શકે માટે તેણે મા-બાપને દેવ બનાવી ધરતી પર મોકલ્યા. આવું જીવન જીવતા હોય તેની દૃઢતા માટે ધર્મસ્થાનકોએ જવાનું હોય છે. આવું જીવન જીવતા હશો પછી ધર્મ સ્થાનમાં જશો તો તમારી ધર્મપ્રત્યેની આસ્થા દૃઢ બનશે જ તેમાં બેમત નથી. તમે જે કોઇપણ સંપ્રદાય કે ધર્મને અનુસરતા હોવ તેઓ પણ આ જ શબ્દો કહેશે કે માતા-પિતા-વડીલો જ નહીં કોઇનાં હૃદયને ન દુભવતા, કોઇનું પડાવી ન લેતા, કોઇનું અહિત ન કરતા.

અંતમાં એટલું જ કહીશ કે જીવનમાં એક વસ્તુ તો તમે અચૂક કરી શકશો. માત્ર માતા-પિતા અને વડીલો જ નહીં જે તમને સામો મળે તેને હસીને, પ્રસન્નચિત્તથી સાંભળજો અને જવાબ આપજો. આજના ફાસ્ટ-ઝડપી યુગમાં સામો વ્યક્તિ પછી તે પરિચિત હોય કે અજાણ્યો તમારી આ લાગણીથી, પ્રસન્નતાથી આકર્ષાયા વગર નહીં રહે અને તમે કોઇને હસાવી શક્યા તો સમજી લેજો કે એક ધર્મપ્રવૃત્તિ તમારાથી સંપન્ન થઇ.

॥ ॐ નમઃ ॥